



આફત જોખમ વ્યવસ્થાપન કાર્યક્રમ



જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન યોજના

જિલ્લો :: – છોટાઉદેપુર

૨૦૧૯-૨૦

ભાગ – ૧

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન એકમ

કલેક્ટર કચેરી, છોટાઉદેપુર

## આમુખ

છોટાઉદેપુર જિલ્લો મુળ વડોદરા જિલ્લામાંથી વિભાજન થઈ તા-૧૫/૦૮/૨૦૧૩ના રોજ નવીન જિલ્લો અસ્તિત્વમાં આવેલ છે. છોટાઉદેપુર જિલ્લામાં આવનાર સંભવિત આફતોને ધ્યાનમાં રાખી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન યોજના તૈયાર કરવામાં આવેલ છે. જેનો મુખ્ય આશય અવારનવાર સર્જાતી કુદરતી અને માનવસર્જીત આફતોથી થતા જાન-માલના નુકશાનનો ઘટાડો કરવાનો છે.


છોટાઉદેપુર જિલ્લાએ છેલ્લા કેટલાક વર્ષો દરમ્યાન વિવિધ પ્રકારની કુદરતી તથા માનવસર્જીત આફતોનો સામનો કરેલ છે. છેલ્લા દસ વર્ષનો ઇતિહાસ ચકાસીએ તો માલુમ પડે છે કે ૨૦૦૨થી વરસાદનું પ્રમાણ દર વર્ષે સતત વધી રહ્યું છે. જેમાં ગ્લોબલ વોર્મિંગની અસરો પણ જવાબદાર છે. આમ, બદલાયેલા સમયમાં આપત્તિ વ્યવસ્થાપન માત્ર ચોમાસાના ચાર માસ પુરતું મર્યાદિત નથી. વારંવાર ત્રાટકતી આપત્તિઓ સામે ઝડપી પ્રતિસાદ આપવા આ પ્રકારની પૂર્વતૈયારી અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન યોજના તૈયાર કરવા ગંભીરતા પૂર્વક વહિવટી તંત્રને પ્રેરીત કર્યા છે.

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન યોજના છોટાઉદેપુર જિલ્લામાં આફતની પરિસ્થિતિ પહેલા, દરમ્યાન અને આફત પછીની પરિસ્થિતિમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર અને વિવિધ ટાસ્કફોર્સને આકસ્મિક સંજોગોમાં ઝડપી પ્રતિભાવ આપવા માટે માર્ગદર્શક રૂપ નિવડશે.

સુજલ મયાત્રા (IAS)

કલેક્ટર છોટાઉદેપુર

## ઘટના પ્રતિભાવ તંત્ર ( Incident Response System )



આપત્તિ ઘટના પ્રતિભાવ પદ્ધતિ મુજબ તેના પ્રતિભાવનું આયોજન કરવામાં આવશે. જિલ્લા સ્તરે મોટી આપત્તિ વખતે ઘટના પ્રતિભાવ તંત્ર (IRS) હેઠળ દરેક ક્ષેત્રવાર પ્રાથમિક અને વૈકલ્પિક જવાબદારી ધરાવતી વ્યક્તિઓને મુકરર કરવામાં આવેલ છે.

- ઘટના નિયંત્રણ (Incident Command Control Room)

- જિલ્લા નિયંત્રણ કક્ષ ( District Control Room)

જિલ્લા નિયંત્રણ કક્ષ, જિલ્લા કલેક્ટરશ્રીની કચેરી ખાતે આવેલો હોય છે. તે માહિતી એકત્રીત કરીને તેની પ્રક્રિયા માટેનું અને આપત્તિ કેન્દ્રિત મથક પણ છે. આપત્તિ વ્યવસ્થાપનના સંબંધમાં લેવાના મોટા ભાગના વ્યવહારાત્મક નિર્ણયો આ નિયંત્રણ કક્ષમાં લેવામાં આવે છે. ઘટના સેનાપતિ ( Incident Commander) જિલ્લા નિયંત્રણ કક્ષનો હવાલો છે. ઘટના નિયંત્રણ તંત્રને વ્યવસ્થાપતંત્ર ચાર્ટ મુજબ સંકટકાલીન કામગીરીઓનું નિયંત્રણ કરે છે. કાર્ય વિશેષ દળ (Task Force) નું નેતૃત્વ લેતી તમામ વ્યક્તિઓ, નિર્ણય લેવાની પ્રક્રિયા માટે એકસૂત્રી સંકલન કરવા માટે ઘટના નિયંત્રણ સેનાપતિની સાથોસાથ જિલ્લા નિયંત્રણ કક્ષ ખાતે સ્થિતિ સંભાળશે.

- કાર્ય વિશેષ દળ નિયંત્રણ કક્ષ

વ્યક્તિગત કાર્ય વિશેષ દળ ની કામગીરીથી, તાલુકા કક્ષાના નિયંત્રણ કક્ષને જિલ્લા કક્ષાના નિયંત્રણ કક્ષ સાથે ટેકનિકલ રીતે સંકલન કરવામાં અને સંચાર વ્યવસ્થામાં કાર્યદક્ષ હોય તેવી સક્ષમ વ્યક્તિથી સજ્જ હોય તેવી કચેરીમાં પોતાના નિયંત્રણ કક્ષને સુપ્રત કરવામાં આવશે અને ચલાવવામાં આવશે તેમજ આપત્તિના સ્થળે જરૂરી સાધનો મોકલશે.

- જિલ્લા નિયંત્રણ કક્ષ ( District Emergency Operation Centre )

જિલ્લામાં કોઈ પણ આપત્તિ દરમિયાન સંકલન સંચાલન થાય તે માટે કલેક્ટર કચેરી ખાતે ઈમરજન્સી ઓપરેશન સેન્ટર સ્થાપિત છે. જ્યાં રાઉન્ડ ધી ક્લોક કંટ્રોલ રૂમ કાર્યરત છે.

જિલ્લા નિયંત્રણ કક્ષ ( District Emergency Operation Centre ) ખાતે સમગ્ર વર્ષ દરમિયાન વર્ગ -3 અને ૪ ના કર્મચારીની ઉપસ્થિતિમાં રાઉન્ડ ધી ક્લોક કંટ્રોલ રૂમ કાર્યરત રહે છે.

• ઘટના નિયંત્રણ સંચાર તંત્ર :

કોઈપણ આપત્તિના અસરકારક નિયંત્રણ માટે સંચાર વ્યવસ્થા અત્યંત મહત્વની બાબત બની જાય છે. આપત્તિ દરમિયાન આપત્તિ વ્યવસ્થાપન ટીમ ધ્વારા અપનાવવામાં આવતી સંચાર વ્યવસ્થા પ્રણાલી નીચે આપેલી છે. આપત્તિના પરિણામે કે તેની અસરને લીધે કોઈ સંચાર વ્યવસ્થા આંતરમાળખું ખોરવાઈ જાય તેવા સંજોગોમાં દૂર સંચાર કાર્ય વિશેષ દળનું નેતૃત્વ લેતી વ્યક્તિ, આપત્તિ વ્યવસ્થાપનની અસરકારક કામગીરી માટે ખલેલ કે અવરોધ વગરની સંચાર વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે આવી સવલત કે આંતરમાળખું તાત્કાલિક પુનઃસ્થાપન થાય તે સુનિશ્ચિત કરશે.

- ટેલીફોન – તમામ નિયંત્રણ કક્ષ ખાતે ટેલીફોન પૂરા પાડવામાં આવેલ છે.
- વૈકલ્પિક સંચાર વ્યવસ્થા .

સંચાર વ્યવસ્થા આંતરમાળખું તુટી પડવાને લીધે તમામ વ્યવસ્થા ઠપ્પ ઠઈ જાય એવી પણ પરિસ્થિતિ ઉભી થવાની સંભાવના હોય છે. સંચાર વ્યવસ્થા ખોરવાઈ જાય તેવા પ્રસંગે આવી સંચાર સવલત/આંતરમાળખું કાર્યરત બને તે રીતે પુનઃસ્થાપિત થઈ જાય ત્યાં સુધી પરિસ્થિતિની ગંભીરતાને લક્ષમાં લઈને વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરવો.

• વાયરલેસ વ્યવસ્થા

અ.નં	સ્થળ
૧	જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ, છોટાઉદેપુર
૨	છોટાઉદેપુર પોલીસ સ્ટેશન
૩	રંગપુર પોલીસ સ્ટેશન
૪	જેતપુર પોલીસ સ્ટેશન
૫	કદવાલ પોલીસ સ્ટેશન
૬	સંખેડા પોલીસ સ્ટેશન
૭	કરાલી પોલીસ સ્ટેશન
૮	નસવાડી પોલીસ સ્ટેશન
૯	કવાંટ પોલીસ સ્ટેશન
૧૦	ઝોઝ રીઈન ગેજ સ્ટેશન
૧૨	સુખી ડેમ સાઈટ, કદવાલ
૧૩	રામી ડેમ સાઈટ, કવાંટ

## ચેતવણી, રાહત અને પુનઃસ્થાપન

### ▪ ચેતવણી

ચેતવણી એ આપત્તિ પહેલાંની પૂર્વ તૈયારી સાથે સંબંધિત છે. આવનારી આફત પહેલા તેના સમાચાર મળે અથવા તેના સંભવના વિષે જાણકારી મળે તો આકસ્મિક આવી પડેલ આફતમાંથી બચી શકાય અને જાનમાલનું નુકસાન ઓછું થાય છે. ડીસ્ટ્રીક્ટ ઓપરેશન સેન્ટર ,કલેક્ટર કચેરી ખાતે સતત ૨૪ કલાક કંટ્રોલ રૂમ ચલાવવા પાછળનો એક આશય આ પ્રકારની આફતો સમયસર ચેતવણી ધ્વારા નુકસાનની શક્યતામાં ઘટાડો કરવાનો છે. જિલ્લામાં કોઈપણ સ્થળે અને સમયે ઘટતી કોઈપણ પ્રકારની ઘટના-દુર્ઘટના સામે પ્રતિસાદ પ્રક્રિયાને વેગ મળે સાહત બચાવ કામગીરી વિના વિલંબે આરંભી શકાય તેમજ જિલ્લા તાલુકા સ્તરના સંબંધિત તમામ અધિકારીશ્રીઓ સાથે જરૂરી સંકલન રાખી શકાય અને ત્વરીત અમલવારી હેતુ જરૂરી સંકલન માટેની આ વ્યવસ્થા છે.

વર્ષાઋતુ દરમ્યાન પુર કે અતિભારે વરસાદની પરિસ્થિતિમાં પહોંચી વળવા હેતુ તાલુકા સ્તરે આગોતરા આયોજન અને પૂર્વતૈયારીના ભાગરૂપ તાલુકા સ્તરે કંટ્રોલરૂમ પહેલી જુનથી શરૂ કરવામા આવે છે. જ્યાંથી ગ્રામ સ્તરે ચેતવણી અને સંદેશાવ્યવહારની કામગીરી હાથ ધરવામાં આવે છે. જેમાં સ્થાનિક સંસાધનોની ઉપલબ્ધી, શોધ-બચાવ અને રાહત કામગીરીની વ્યુહરચના, મહત્વના નંબરોની સૂચીનો સમાવેશ કરવામાં આવે છે. વધુમાં આ સમગ્ર યોજનાનું એસ.ડી.આર.એન પર પણ અપડેશન આ ગાળા પૂર્વે કરી લેવામા આવે છે.

આફત આવવાનો કોઈ નિશ્ચિત સમય હોતો નથી ત્યારે સ્થાનિક વહિવટી તંત્રની સજ્જતા અને સતર્કતાની સાથે સાથે આંતરિક સંકલનની ચકાસણી હેતુ મોકડ્રિલનું આયોજન સમયાંતરે કરવામાં આવે છે અને તે દરમ્યાં જણાતી ખામીઓ ક્ષતિઓની સમિક્ષા કરી ભવિષ્યમાં તે પૂનરાવર્તિત ન થાય તે માટેની કાળજી રાખવામાં આવે છે.

કોઈ પણ આપત્તિ રોકી શકાતી નથી પરંતુ તેની સામેની પૂર્વતૈયારી અને સજ્જતાથી તેની ભયાનક અસરો અને તિવ્રતામાં ઘટાડો જરૂર કરી શકાય છે. જે અન્વયે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા અમલી બનેલ આફત જોખમ વ્યવસ્થાપન કાર્યક્રમ થકી સમુદાય સ્તરે વિવિધ સમુહો માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત સમયાંતરે આફત સામે પૂર્વતૈયારીના વિચારને વિવિધ માધ્યમો થકી જન-જાનૃતિ લક્ષી વિવિધ કાર્યક્રમો દ્વારા લોકો વચ્ચે પહોંચાડવામાં આવે છે.

આ ઉપરાંત સંબંધિત વિભાગો જેવા કે ,પોલીસ,પંચાયત ,માર્ગ અને મકાન ,વન વિભાગ , શિક્ષણ, આરોગ્ય વગેરેને જરૂરી સંકલનમાં રહી કામગીરી કરવા માટે સૂચિત કરવામાં આવે છે. તાલુકા સ્તરે તાત્કાલિક પ્રતિસાદ માટે લાયઝન અધિકારીશ્રીઓની નિમણૂક કરેલ છે. તમામ લાયઝન અધિકારીશ્રીઓને આપત્તિના સમયે સજાગ, સતર્ક તેમજ તાલુકાસ્તરે સંકલનમાં રહે છે.

તાલુકા સ્તરે ઉપલબ્ધ કરાવવામાં આવેલ શોધ-બચાવના સાધનો,લાઇફ જેકેટ ,લાઇફ રીંગ,દોરડા, તેમજ વરસાદ માપક યંત્રને કાર્યરત સ્થિતિમાં રાખવું.


#### ▪ રાહત

આફત દરમ્યાન તથા આફત ત્રાટક્યા બાદનો તબક્કો છે.આફતથી થયેલ નુકશાનના કારણે વ્યક્તિ માનસીક, શારીરિક તથા આર્થિક રીતે ભાંગી પડ્યો હોય છે. જે વ્યક્તિ અથવા સમુદાયને સમાજમાં ફરીથી તે પગભાર થઈ શકે તે માટે સરકારશ્રી ધ્વારા લેવામાં આવેલ નિર્ણય સર્વોપરી છે.

#### ▪ પુનઃસ્થાપન

આ એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં જન સમુદાય આપત્તિ પછી આપત્તિ પરેલાની પુર્વવત પરિસ્થિતિમાં લાવવા માટે કરવામાં આવતી તમામ પ્રકારની સહાયનો સમાવેશ થાય છે.આ પ્રક્રિયા ઘણા લાંબાગાળાની પ્રવૃત્તિ છે. તે ક્યારેક પાંચ ,દશ વર્ષ અથવા તેથી વધુ સમય પણ વ્યતિત થઈ શકે છે.

### THE COMMUNICATION FLOWCHART





## ભૂમિકા અને જવાબદારી

પૂર્વ ચેતવણી અને આપત્તિ સંબંધી બચાવ રાહત કામગીરી અને આપત્તિ પછીના રીપોર્ટ માટે.

ઘટના નિયંત્રણ તંત્ર/ગુજરાત રાજ્યના માળખાની તુલનામાં કાર્ય વિશેષ દળ				
ક્રમાંક	કાર્યદળ	નેતૃત્વ લેનાર અધિકારી	સહાય કરતા સભ્યો/સંગઠનો	ઘટના નિયંત્રણ તંત્ર/વિભાગ/ એકમ
૧	સંકલન અને આયોજન	કલેક્ટર	જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક, અધિક નિવાસી કલેક્ટર અને મામલતદાર	આયોજન
૨	વહીવટી અને પ્રોટોકોલ	અધિક જિલ્લા કલેક્ટર	જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક, અધિક નિવાસી કલેક્ટર અને મામલતદાર	નાણા અને વહીવટ
૩	ચેતવણી	અધિક નિવાસી કલેક્ટર	અધિક નિવાસી કલેક્ટર, ડેપ્યુટી મામલતદાર, નિયંત્રણ કક્ષ	કામગીરી (ઓપરેશન)
૪	કાયદો અને વ્યવસ્થા	જિલ્લા પોલીસ અધિક્ષક	નાયબ પોલીસ અધિક્ષક, ગૃહ રક્ષક દળ સેનાપતિ, બીન સરકારી સંગઠન અને અર્ધલશ્કરી દળ	કાયદો અને વ્યવસ્થા
૫	શોધ અને બચાવ	ડેપ્યુટી કલેક્ટર	મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ, કાર્યપાલક ઈજનેર, અગ્નિશમન દળ, માર્ગ પરિવહન અધિકારી, રાજ્ય પરિવહન, આરોગ્ય વિભાગ	કામગીરી (ઓપરેશન)
૬	જાહેર બાંધકામ	કાર્યપાલક ઈજનેર, (માર્ગ અને મકાન (રાજ્ય)	સિંચાઈ, કાર્યપાલક ઈજનેર, પંચાયત બીન સરકારી સંગઠન, પાણી પુરવઠા બોર્ડ, નગરપાલિકાઓ, ગૃહ રક્ષક દળ, પોલીસ	કામગીરી (ઓપરેશન)
૭	આશ્રય	જિલ્લા પ્રાથમિક	શાળાના આચાર્ય, શિક્ષકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, રાજ્ય પરિવહન, પાણી	ઓપરેશન

		શિક્ષણ અધિકારી	પુરવઠો, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી	(કામગીરી)
૮	પાણી પુરવઠો	કાર્યપાલક ઈજનેર, ગુ.પા.પુ. અને ગ.વ્ય. બોર્ડ, કાર્યપાલક ઈજનેર વોટરવર્ક્સ મ્યુ.કોર્પો.	નાયબ કાર્યપાલક ઈજનેર, તલાટી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, આરોગ્ય, નાયબ ઈજનેર, મ્યુનિસિપલ કોર્પોરેશન	ઓપરેશન (કામગીરી)
૧૦.	વીજળી	અધિક્ષક ઈજનેર, ગુ.વિ.બો.	કાર્યપાલક ઈજનેર, નાયબ ઈજનેર, ટેકનિકલ, ગુ.વિ.બો. પરિવહન	કામગીરી (ઓપરેશન)
૧૧.	જાહેર આરોગ્ય અને સ્વચ્છતા	સીડીએચઓ (CDHO)	હોસ્પિટલ સુપ્રિટન્ડેન્ટ, મ્યુ. કોર્પોરેશનના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સીએચસી, નગરપાલિકા, રેડક્રોસ, અગ્નશમનદળ, નાગરિક સંરક્ષણ, બીન સરકારી સંગઠનો, ડોક્ટરો, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર	કામગીરી (ઓપરેશન)
૧૨	સહાયક તંત્ર	જિલ્લા વિકાસ અધિકારી	આરટીઓ, જિલ્લા પુરવઠા અધિકારી, એફપીએસ, ખાનગી અને જાહેર ક્ષેત્રો, મ્યુનિસિપલ પાણી પુરવઠા બોર્ડ, મામલતદાર, જિલ્લા પુરવઠા મામલતદાર	સહાયક તંત્ર (લોજિસ્ટીક)
૧૩	પશુ આરોગ્ય અને કલ્યાણ	નાયબ નિયામક પશુસંવર્ધન	વેટરનરી ઈન્સ્પેક્ટર, બીન સરકારી સંગઠનો	ઓપરેશન (કામગીરી)
૧૪	રાહત પુરવઠો	જિલ્લા વિકાસ અધિકારી	સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ, બીન સરકારી સંગઠનો, આરટીઓ, પાણી પુરવઠો, ગુ.વિ.બોર્ડ, આરોગ્ય, ગૃહ રક્ષક દળ, ડીઆરડીએ, નગરપાલિકા, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી	

૧૫	સંચાર વ્યવસ્થા	અધિક નિવાસી કલેક્ટર	ડેપ્યુટી મામલતદાર, મોબાઈલ ઓપરેટર, ટીવી રેડિયો, બંદર કચેરી, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, પોલીસ, વન	સહાયક તંત્ર
૧૬	માધ્યમ	જિલ્લા માહિતી અધિકારી	મુદ્રણ માધ્યમ, ટીવી, પત્રકારો, બીન સરકારી, સંગઠનો	જાહેર માહિતી
૧૭	મોજણી	અધિક જિલ્લા કલેક્ટર	ડીઆઈસી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, કાર્યપાલક ઈજનેર (મા. અને મ.વિ.), મત્સ્યોદ્યોગ	આયોજન

ટાસ્કફોર્સ - સંકલન અને આયોજન :- પૂર્વ ચેતવણી.સ્થળ ખાલી કરાવવા અને સંદેશા વ્યવહાર,પુનઃસ્થાપન કામગીરીનું સંકલન કરવું

કાર્ય વિશેસ દળના સુકાનિ : કલેક્ટર

ક્રમ	સમય પત્રક	ટાસ્ક	વિભાગ	પ્રવૃત્તિ
૧	સામાન્ય સમય	રાજ્ય સ્તરે તેનું જોડાણ અને ઘટના નિયંત્રણનું સ્થાપન	ડી.ડી.એમ.સી., પંચાયત મહેસુલ વિભાગ	ગ્રામીણ સ્તરે આપત્તિ વ્યવસ્થાપન સંચાર સ્થાપવું.જિલ્લા કક્ષા સહીત તમામ સ્તરે આપત્તિ વ્યવસ્થાપન યોજન વિકસાવવી. કાઈસીસ મેનેજમેન્ટ કમીટી (કલેક્ટર) સાથે બેઠક યોજવી. (ઔદ્યોગીક,આરોગ્ય અને સ્વાસ્થ્ય વિભાગ)
૨		સંચાર	પોલિસ	તમામ સ્તર ના કાર્યદળો સાબદા રાખવા
૩		વ્યવસ્થાતંત્ર અને કાર્યરિતી	માહિતી વિભાગ	માહિતી પ્રચાર-પ્રસાર
૪		ડી.ડી.એમ.સી ટી.ડી.એમ.સી વી.ડી.એમ.સી	સંભવિત જોખમો,પૂર્વતૈયારી અને સાવચેતીના પગલા અંગે લોક જાગૃતિ કરવી	
૫		પોલીસ, નગરપાલિકા, આર એન્ડ બી	કાર્યદળ તૈયાર કરવા, તાલીમો કરવી, સાધનો અને યંત્રોની મરામત કરી તૈયાર રાખવા	
૬	ટી.ડી.એમ.સી	શોધ બચાવ અને પૂર્વ ચેતવણી,સ્થળ ખાલી		

			એસ.ડી.એમ	કરાવવા અને સંદેશાવ્યવહાર અંગે વિવિધ હિતધારકો સાથે બેઠક કરવી અને આયોજન કરવું.
૭	૭૨ થી ૪૮ કલાક (આફતના ૩ દિવસ પહેલા)	યોજના	મહેસુલ પંચાયત અને પોલીસ	મેળવેલ ચેતવણી ચકસવી અને પુનર્વશન પ્રવૃત્તિઓ શરૂ કરવી.
૮				ગામ પંચાયત અને જિલ્લા કક્ષાએ કાર્યરત સંચાર અને ચેતવણીની વ્યવસ્થા ચકાસણી કરવી
૯				સલામત સ્થળે ખસેડનાર ટીમને જરૂરી યંત્રો અને સાધનો સાથે ઘટના સ્થળે મોકલવા.
૧૦				ટીમ અને સમુદાય બન્ને માટે વાહનોની વ્યવસ્થા કરવી.
૧૧				અસગ્રસ્ત સમુદાય અને પશુઓ માટે સલામત રેસ્ક્યુ સેલ્ટર અને જગ્યાઓ પસંદ કરવી.
૧૨				સ્થાનિક સ્થિતિ અંગે જિલ્લા અને રાજ્યના ઈમરજન્સી ઓપરેશન સેન્ટરને જાણ કરવી.
૧૩				ચેતવણીઓના સંદેશા વ્યવસ્થા તંત્ર તૈયાર કરવા
૧૪				છેલ્લા સ્થળ સુધી સ્થાનિક ભાષામાં પૂર્વ ચેતવણી પહોંચાડવી, મૌખિક રીતે ફોનથી, ટેલીવિઝનથી, રેડિયોથી, ન્યુઝ પેપરના માધ્યમનો ઉપયોગ કરવો. વીજળીના આધાર વિનાની વ્યવસ્થાઓનો ઉપયોગ કરવો (કેટલાંક સમયના વિરામ પછી ચેતવણીઓને વારંવાર પુનઃપ્રસારિત કરતા રહેવું)
૧૫				ટેલીફોન સંપર્ક સૂચિ અને કાર્યદળની SOP અપડેટ છે કે નહિ તેની ખાત્રી કરી લેવી.
૧૬				અન્ય ટાસ્કફોર્સ સાથે સંકલન કરવું. (શોધ અને બચાવ, જાહેર આરોગ્ય, કાયદો અને વ્યવસ્થા અને પાણી પુરવઠો)
૧૭	સંભવિત સંકટ વિશે જિલ્લા અને રાજ્ય			

				સત્તાધિકારીઓને જાણ કરવી.	
૧૮				સ્થાનિક સ્તરની તૈયારીઓની ચકાસણી કરવી અને ઈન્સીડન્ટ કમાન્ડર અધિકારીને જાણ કરવી	
૧૯	D-48 to 24 hours (Before 2 days of Disaster)		ડી.ડી.એમ.સી	જિલ્લા સ્તરે આફત વ્યવસ્થાપન કમિટી અને ઈમરજન્સી રીસપોન્સ મેનેજમેન્ટ કમિટીએ સ્થિતિ પર નિયંત્રન રાખવું.	
૨૦			આઈ.એમ.ડી	પહેલા જાહેર કરેલા સત્તાવાર પૂર્વ ચેતવણીઓના સંદેશાઓને આવતા ૨૪ કલાક માટે અપડેટ કરી જાહેર કરતા રહેવું.	
૨૧			પંચાયત	પૂર્વ ચેતવણી પહોંચી છે તેનો પ્રતિભાવ મેળવવો અને સ્થાનિક પરિસ્થિતિની માહિતી મેળવવા માટે અધિકારીઓને તાકિદ કરવા.	
૨૨				સ્થાનિક સ્તરની તૈયારીઓની ચકાસણી કરવી અને ઈન્સીડન્ટ કમાન્ડરને રીપોર્ટ કરવો.	
૨૩			ડી.ઈ.ઓ.સી	એસ.ઈ.ઓ.સી સાથે નિયમિત સંપર્ક સ્થાપિત કરવો.	
૨૪			પોલીસ	રેસ્ક્યુ સેલ્ટર અને જોખમી જગ્યાઓએ જરૂરી સાધનોની વ્યવસ્થા કરવી(બોટ,તરવૈયા,પ્રાથમિક સારવાર, )	
૨૫				જોખમ સ્થળે પહોંચવા માટેના વૈકલ્પિક રસ્તા નક્કી કરવા.	
૨૬				ફોરેસ્ટ	સ્થાનિક સ્તરની તૈયારીઓની ચકાસણી કરવી અને ઈન્સીડન્ટ કમાન્ડરને રીપોર્ટ કરવો.
૨૭					પૂર્વ ચેતવણી ખાસ નિ:સહાય સમૂહ સુંઘી પહોંચે તેની ખાતરી કરવી.
૨૮			D-24 to 12 hours	શોધ અને બચાવ	
૨૯	ડી.ડી.એમ.સી	લેટેસ્ટ સ્થિતિ વિશે સ્થાનિક ભાષામાં પૂર્વ ચેતવણી પહોંચતી કરવી.અગાઉ જણાવ્યા મુજબના માધ્યમોનો ઉપયોગ કરવો.			
૩૦		સંકટ પરિસ્થિતિ વિશેની વિગતવાર માહિતી બચાવ ટાસ્કફોર્સ અને અન્ય ટાસ્કફોર્સને આપવી.			

૩૧				અંતિમ સ્થળ સુધી પૂર્વ ચેતવણી પહોંચી કે નહિ તેની ચકાસણી કરવી.
૩૨				બચાવ ટુકડીઓને એક્શન માટે તૈયાર રાખવી. દરેક ટુકડીને જોખમના સ્થળ અને જેનો બચાવ કરવાનો છે ત્યાં પહોંચવાના રસ્તા વિશે જાણ કરવી.
૩૩				બચાવ ટુકડીઓને માટે ખોરાક, રહેવાની અને સુરક્ષાની વ્યવસ્થા કરવી.
૩૪				દરેક બચાવ ટુકડાની હલચલની જાણકારી લેવી અને ઉપરી અધિકારીને દર ૬ કલાકે જણાવવી.
૩૫				પૂર્વ ચેતવણી અંગેના સંદેશાઓ સતત પહોંચી રહ્યાં છે કે નહિ તેની ખાત્રી કરવી.
૩૬	D-12 to 0 hours	ચેતવણી	જિલ્લા કંટ્રોલ રૂમ ડી.ઈ.ઓ.સી	પરિસ્થિતિ પર દેખરેખ રાખવી અને તેના વિશેનઓ લેટસ્ટ રીપોર્ટ ઉચ્ચ અધિકારીશ્રીઓને, જિલ્લા કલેક્ટરશ્રીને અને આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળને કરવો.
૩૭				બચાવ ટુકડીની કામગીરીની દેખરેખ કરવી અને વિશેષ યંત્રો, મશીનરી, કૌશલ્યબદ્ધ વ્યક્તિઓ, દવાઓ, વગેરે જરૂરીયાતની સૂચી તૈયાર કરવી.
૩૮				જરૂરી સાધન સામગ્રી એકત્રીત કરી ઘટના સ્તરે પહોંચાડવી.
૩૯	D+1 to 12 hours	મૃતદેહ નિકાલ	પોલીસ અને આરોગ્ય	પોલીસ અને સ્થાનિક આગેવાનો સાથે સંકલન માટે એક અધિકારીને નિયુક્ત કરવા જે મૃતદેહની યોગ્ય તપાસ અને નોંધણી બાદ નિકાલ કરાવે.
૪૦				ખોરાક અને પાણીની વિશેષ જરૂરીયાતો માટે જિલ્લા સ્તરેથી મદદ માટે DEOC સાથે સંકલન કરવું.
૪૧				વધારાની ટુકડી તૈયાર રાખવી જેથી વારાફરતી આરામ મળી રહે.
૪૨	D+12 to 24 hours	રાહત બચાવ	જિલ્લા વિકાસ અધિકારી અને	શોધ અને બચાવની કામગીરી ચાલુ રાખવી અને અસગ્રસ્તોને જરૂર મુજબની સલામત

			તેમની ટીમ	સ્થળો/દવાખને/રીલીફ કેમ્પમાં લઈ જવા.
૪૩			જિલ્લા પોલીસ અધિક્ષક	અસરગ્રસ્તોને વિશેષ પ્રકારની તબીબી સારવારની જરૂર હોય તો DEOC સાથે સંકલન કરી વ્યવસ્થા કરવી.
૪૪				જરૂર હોય તો હવાઈ માધ્યમો દ્વારા સેવાઓ આપવી
૪૫				હેલ્પ લાઇન નંબર અને સહયોગ કેન્દ્રો શરૂ કરવા
૪૬				ક્લસ્ટર સ્તરે સ્થાનિક લોકો સાથે મિટીંગ કરી સ્થિતિનું આંકલન કરવું અને જિલ્લા અધિકારીને રોજ સાંજે અહેવાલ કરવો.

ટાસ્કફોર્સ - સહાયક તંત્ર - અન્ય કાર્યદળ અને સક્ષમ સત્તાધિકારીઓ સાથે સંકલન કરી સ્થળાંતર અને રાહત, પુરવઠાના સંગ્રહ અને રાહત માટે પરીવહન જોગવાઈ કરે છે.

કાર્ય વિશેષ દળના સુકની : જિલ્લા વિકાસ અધિકારીશ્રી.

ક્રમ	સમય પત્રક	ટાસ્ક	અમલ કરનાર વિભાગ	પ્રવૃત્તિઓ
૧	સામાન્ય સ્થિતિમાં			વિવિધ આપત્તિઓ દરમિયાન આવશ્યક સાધન સામગ્રીની સુચી તૈયાર કરવી
૨				વિવિધ સ્તરે મોકડીલનું આયોજન કરવું. અન્ય કાર્યદળો સાથે સંકલન કરવું.
૩	D-24 hours	કાર્ય વહેંચણી અને જરૂરીયાત ધરાવતા ક્લસ્ટરની ઓળખ		કાર્યદળના સભ્યોને સાબદા કરવા અને કામ સોંપણી કરવી.
૪				અપેક્ષિત આપત્તિ પર આધારીત ટુંકાગાળાની સુચના પરની કાર્યવાહી માટે વાહનો અને અન્ય સાધનોને કામે લગાડવા.
૫				નિયંત્રણ કક્ષ અને શોધ બચાવ, આશ્રય અને રાહત પુરવઠો કાર્યદળ સાથે સંપર્કમાં રાખવો.
૬	D+24 hours			બહારથી સાધન સામગ્રી મંગાવવાની જરૂર પડે તો તેની સમીક્ષા કરવી.
૭				આપત્તિના પ્રકારોને ધ્યાનમાં રાખી સહાયક તંત્રનું

			આયોજન (કાર્યદળ)
૮			નિયંત્રણ અને સ્ત્રોતોની સતત સુચના આધારીત કાર્યયોજના હાથ ધરવી.
૯			જરૂરીયાત અને સ્ત્રોતની સતત સમીક્ષા કરવી.
૧૦			નિયંત્રણ કક્ષ અને મહત્વના કાર્યદળોનો સંપર્ક સંગીન બનાવવો.
૧૧			સેવાઓની ગુણવત્તા અંગે ચકાસણી કરવી.
૧૨			સહાયક તંત્ર માટે વધતી માંગનો પ્રતિભાવ આપવો.
૧૩	D+day 2 and ahead	રીપોર્ટીંગ અને ફાઈનલ દસ્તાવેજીકરણ	નિયમિત રીપોર્ટીંગ અને દસ્તાવેજીકરણ કરવું.
૧૪			જરૂરીયાતો અને માંગણીઓનું પુનઃમૂલ્યાંકન કરવું.
૧૫			યોગ્ય જણાય તેમ સાધન સામગ્રી પૂરી પાડવી
૧૬			બોધપાઠ બેઠક જેમાં આશ્રય,ખાદ્ય અન્ય રાહત પુરવઠા કાર્યદળ યોજવી.

ટાસ્કફોર્સ - શોધ અને બચાવ (સ્થળાંતર સહીત) : સ્થાનિક સ્થળાંતર શોધ અને બચાવના પ્રયાસમા મદદ કરવા માટે માનવ અને મહત્વના સાધનો પુરા પાડે છે.

ક્રમ	સમય પત્રક	ટાસ્ક	અમલ કરનાર વિભાગ	પ્રવૃત્તિ
૧	સામાન્ય સમય	જોખમ મૂલ્યાંકન અને સંવેદનશીલતા	પોલીસ, મહેસુલ, પંચાયત	વિવિધ આપત્તિઓ દરમિયાન શું કરવું ? અને શું ન કરવું ? તે અંગેના જન-જાગૃતિના કાર્યક્રમો કરવા.
૨				સંપર્ક સરનામા સુધારવા, સંસાધનોની સૂચિ સુધારવી, વ્યૂહાત્મક આગોતરી વ્યવસ્થાની દેખરેખ, કાર્ય યોજનાની સમયાંતરે દેખરેખ
૩				નિયમિત રીતે સાધનો, યંત્રોની મરામત અને જાળવણી કરવી, ખાસ યંત્રોની ખરીદી/ઉપલબ્ધ કરાવવા.
૪				ડી.ઈ.ઓ.સી, પોલીસ



૫	D-72 to D-0 દરમ્યાન	પરિસ્થિતિનું આંકલન	નિવાસી અધિક કલેક્ટર	શોધ અને બચાવની તાલીમ માટેનું આયોજન.	
૬				જોખમનું આંકલ કરતા જવું અને કામગીરી કરતા જવું.	
૭				વિવિધ વિભાગો સાથે સંકલન શોધ અને બચાવ માટે વિશેષ દળની જરૂરીયાત હોય તો વ્યવસ્થા કરવી.	
૮				કંટ્રોલ રૂમનું સંચાલન : બહારના નિષ્ણાંતોની ટીમ, લશ્કરી ટુકડી, ફાયર વિભાગ, સિવિલ ડીફેન્સ, પોલીસદળ વગેરે સાથે સંકલન અને કામગીરી.	
૯	D+1 to 24 hours	કાયદો અને વ્યવસ્થા	જિલ્લા પોલીસ અધિક્ષક	આગોતરી ચેતવણી વગરનું સંકટ હોય તો બચાવ દળોને તેમના સાધન અને યંત્રો સાથે ઘટના સ્થળે તરા જ પહોંચવા તાકીદ કરવા.	
૧૦				ઘટના સ્થળને જરૂર હોય તો કોર્ડન કરી લેવું.	
૧૧				આવેલ આપત્તિ સંદર્ભે દરેક સ્તરની ટાસ્કફોર્સને તાકીદ કરવી.(જિલ્લા, તાલુકા, ગામ)	
૧૨				શોધ અને બચાવ સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવા.	
૧૩				લોકોના ટોળાને કાબૂમાં લેવાની વ્યવસ્થા કરવી.	
૧૪				જિલ્લા	અસરગ્રસ્તોને સલામત સ્થળે લઈ જવા.
૧૫				શિક્ષણાધિકારી	સ્થાનિક સ્તરની તૈયારીઓની ચકાસણી કરવી અને ઈન્સિડન્ટ કમાન્ડરને રીપોર્ટ કરવો.
૧૬	D+24 hours and ahead	તમામ સ્તરનું રીપોર્ટીંગ કામગીરી	નિવાસી અધિક કલેક્ટર	ટાસ્કફોર્સની કામગીરી અંગે નિયમિત અહેવાલ તૈયાર કરવો.	
૧૭				સ્ટાફનું રોટેશન ચાલુ રાખવું.	
૧૮				કામગીરીની સતત સમીક્ષા અને આંકલન કરવું	
૧૯				ફાઈનલ રીપોર્ટ તૈયાર કરવો. વિવિધ હિતધારકોનો તેનમા સહયોગ બદલ આભાર માનવો.	

ટાસ્કફોર્સ - નુક્સાન આકારણી , સર્વે અને દસ્તાવેજીકરણ

કાર્યદળનું નેતૃત્વ લેનાર અધિકારી : કાર્યપાલક ઈજનેર , માર્ગ અને મકાન

ક્રમ	સમય પત્રક	ટાસ્ક	અમલ કરનાર વિભાગ	પ્રવૃત્તિઓ
૧	સામાન્ય સ્થિતિમાં		ડી.ઈ.ઓ.સી	રાજ્યની ઓથોરીટી દ્વારા તૈયાર કરવામાં આવેલા નુક્સાન આકારણી પત્રક મેળવવા અને આકારણી કરવી.આકારણી કરવા માટે ચાર પ્રકારની ટીમ બનાવવી (૧) ખાનગી ભવન અને મકાન (૨) રસ્તા, પુલ, ટેલીફોન સંદેશાવ્યવહાર તેમજ જાહેર ભવનો (૩) ખેતી અને જળ સંસાધન (૪) ઉદ્યોગ અને વ્યાપાર
૨				નુક્સાન આકારણી કરી શકે તેવા વ્યક્તિઓના સરનામાં અને ટેલીફોન નંબર સહિતની યાદી તૈયાર કરવી.
૩	D+24 hours	નુક્સાન આકારણી	R&B અને PWD તથા પંચાયત	નુક્સાનીના આંકલન માટે વ્યક્તિગત અને બીજા જરૂરી સંસાધનોનું અંદાજિત ખર્ચ પત્રક બનાવવું.
૪				નુક્સાનીનું આંકલન કરનાર ટીમ નુક્સાનીનું પ્રાથમિક આંકલન તૈયાર કરશે.આંકલન માટેના પૂર્વ તૈયારી ફોર્મેટનો ઉપયોગ કરવો.
૫				પ્રાથમિક નુક્સાનીના આંકલનનો રીપોર્ટ ઉપરી સત્તામંડળને મોકલવો
૬				પ્રાથમિક આંકલનમાં સુધારા વધારા અને નુક્સાનની જટિલતા વિશેના અભિપ્રાયો મેળવવા. આંકલનની વિગતોમાં કોઈપણ પ્રકારની સ્પષ્ટતા માટે ઉપરી સત્તામંડળને જાણ કરવી.
૭	D+24 to 72 hours and beyond	ફરીયાદ નિવારણ	પંચાયત (ગ્રામીણ વિસ્તાર માટે) નગરપાલીકા (શહેરી વિસ્તાર માટે)	નુક્સાન આંકલન માટે ટીમો તૈયાર કરવી અને ચોક્કસ નુક્સાન વાળા વિસ્તાર ફાળવવા.

૮				નુકસાનના આંકલન સમયે કોઈપણ પ્રકારની ટેકનીકલ માહિતીની જરૂર માટે આંકલન કરતાને એક માહિતીની નકલ આપવી જેના આધારે તે સ્થળ પર જ લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરી શકે.
૯				નુકસાન આંકલન ડેટા કમ્પ્યુટરાઈઝ્ડ કરવા ડેટા ઓપરેટરની ટીમ બનાવવી અને તેઓ વિના વિલંબે ડેટા એન્ટ્રી કરે તે ધ્યાન રાખવું.
૧૦				જિલ્લા સ્તરે ફરિયાદ નોંધવા અને ફરિયાદ નિવારણની વ્યવસ્થા કરવી.
૧૧				જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી સતત રીવ્યું અને આંકલન કરતા રહેવું.
૧૨				ઉપરી સત્તાધિકારીને અધિકૃત રીતે ફાઈનલ રીપોર્ટ જમા કરાવવો.

ટાસ્કફોર્સ - રાહત શિબિર વ્યવસ્થાપન : ( હંગામી આવાસો , ખોરાક , પાણી, વીજળી, આરોગ્ય) મનો

સામાજિક સંભાળ

કાર્યદળનું નેતૃત્વ લેનાર અધિકારી : જિલ્લા પુરવઠા અધિકારી

ક્રમ	સમય પત્રક	ટાસ્ક	અમલ કરનાર વિભાગ	પ્રવૃત્તિ
૧	સામાન્ય સમયમાં		જિલ્લા શિક્ષણાધિકારી/ સમાજ કલ્યાણ અધિકારી	રાહત કેમ્પની જગ્યા નક્કી કરવી અને તેની ક્ષમાતા અને ઉપલબ્ધ માળખાગત અસુવિધાઓનું પત્રક બનાવવું.
૨				સમુદાયના સભ્યોમાંથી, ધાર્મિક સંસ્થાઓ, કોર્પોરેટ ક્ષેત્રોમાંથી જે સ્વૈચ્છિક રિતે તેમની સેવાઓ રાહત કેમ્પની વ્યવસ્થામાં આપવા ઈચ્છુક હોય તેવા લોકોની ટીમ બનાવવી. તેમના નામ અને સંપર્કની યાદી બનાવવી.
૩				રાહત કેમ્પ વ્યવસ્થામાં મહિલાઓ, બાળકો, વિકલાંગો, વૃદ્ધો, દલિત અને લઘુમતિ સમુદાયો પ્રત્યે સંવેદનશીલતા વધે તે માટે કાર્યશાળા આયોજન કરવું.
૪				રાહત કેમ્પના સ્થળે માળખાગત સુવિધાઓના

				સુધારા-વધારા માટે સરકારી કાર્યક્રમો અને અન્ય હિતધારકો સાથે જોડાણ કરવું.
૫	D-24 hours	રાહત કેમ્પ વ્યવસ્થા	જિલ્લા શિક્ષણાધિકારી	રાહત કેમ્પની જગ્યા અને બચાવ આવાસની સ્થિતિની ચકાસણી કરવી.
૬				ચકાસણી રીપોર્ટના આધારે જરૂરી સાધનસામગ્રીને એકઠી કરવી.
૭				રાહત કેમ્પની વ્યવસ્થા માટે સ્થાનિક ટીમ બનાવવી.
૮				પાણી પુરવઠા, સ્વાસ્થ્ય, વીજળી વિભાગના અધિકારીઓ સાથે રાહત શિબિર સ્થળે તેમની સેવાઓ લેવા માટે મીટીંગ કરવી.
૯		કાઉન્સિલીંગ	જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી	આવાસ અને મનોસામાજિક સંભાળ માટે ખાસ ટીમ બનાવવી.
૧૦	D 0 to D +24 hours	રહેઠાણ અને આરોગ્ય સંબંધિત બાબતો	આરોગ્ય, પંચાયત, અને સ્વૈચ્છિક સંસ્થાઓ, જિલ્લા પુરવઠા નાયબ મામલતદાર (પુરવઠા તમામ) સમાજ કલ્યાણ અધિકારી	ચોક્કસ સ્થળોએ રાહત કેમ્પ વ્યવસ્થા માટે મિટીંગ કરવી અને સ્થાનિક સંસ્થાઓ અને સ્વયં સેવકો સાથે જવાબદારી નક્કી કરવી. સ્થાનિક જરૂરીઆતોવિશે અહેવાલ જાહેર કરવો.
૧૧				ખોરાક અને અન્ય જરૂરી સામગ્રી આપવા માટે સ્થાનિક સંસ્થાઓને વિનંતી મોકલવી.
૧૨				તમામ વર્ગના અસરગ્રસ્તોની જરૂરયાતોના સહયોગ માટે પ્રાથમિક અંદાજપત્રક તૈયાર કરવું. પાણી, આરોગ્ય અને સ્વચ્છતા, હિંસા, અને ભેદભાવ જેવી માનવીય સંબંધિત સમસ્યાઓની સ્થિતિની ચકાસણી કરવી.
૧૩				રાહત સ્થળની સ્થિતિ મુજબ સંસાધનો ખરીદવા
૧૪				એક દિવસમાં એક ટીમને સતત ૧૨ કલાકથી વધુ સમય માટે કામ ન કરવું પડે તે માટે વ્યક્તિગત અને જરૂરી સંસાધનોનું અંદાજપત્રક બનાવવું.
૧૫				સમાજ સુરક્ષા અધિકારી

				કાર્ય અસરકારક અને ભેદભાવ રહિત થાય છે કે નહિ તેની દેખરેખ રાખશે.
૧૬				વ્યવસ્થામાં આવરી લીધેલ અને નવી જરૂરીયાતોને પહોંચાડવાની બાબતો અંગેના સહયોગ માટેનો દૈનિક રીપોર્ટ તૈયાર કરવો અને તેને ઉપરી અધિકારીને મોકલવો.
૧૭				સ્વાસ્થ્ય, પાણી પુરવઠા, મનોસામાજિક સંભાળ અને આવાસ માટે ટુકડીઓ બનાવવી.
૧૮	D+1 day and ahead	રાહત કેમ્પની જરૂરીયાતની ચકાસણી	પંચાયત અને આરોગ્ય વિભાગ	રાહત કેમ્પની જરૂરીયાત છે કે બંધ કરવો છે તે અંગે સ્થાનિક લોકો સાથે વિચાર વિમર્શ કરી ભાવિ કાર્ય નક્કિ કરવું.
૧૯				રાહત કાર્ય ચાલુ હોય ત્યારે નક્કિ કરેલા પહેલાના તમામ કાર્યો કરવા.
૨૦			સમાજ સુરક્ષા અધિકારી	મનોસામાજિક સંભાળ અને સ્વાસ્થ્ય અંગેના સાપ્તાહિક અને પખવાડિક અહેવાલ તૈયાર કરવા.

ટાસ્કફોર્સ – જાહેર આરોગ્ય અને સ્વચ્છતા-આરોગ્યને લગતી સમસ્યા સંબંધી કર્મચારીગણ અને સંસાધન પુરા પાડે છે. સામાન્ય તબીબી સંભાળ વ્યવસ્થાતંત્ર પુનઃસ્થાપિત કરે છે.

કાર્યદળનું નેતૃત્વ લેનાર અધિકારી : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી.

ક્રમ	સમય પત્રક	ટાસ્ક	અમલ કરનાર વિભાગ	પ્રવૃત્તિ
૧	સામાન્ય સ્થિતિ D-24 hours	તબીબી આવશ્યક જથ્થાની ચકાસણી	આરોગ્ય વિભાગ	ડોક્ટર, નર્સ, ખાનગી અને સરકારી દવાખાના સરનામા અને સંપર્કની માહિતી તથા બેડ અને એમ્બ્યુલન્સની ઉપલબ્ધતા અંગેની માહિતીનું પત્રક બનાવવું.
૨				પ્રાથમિક સારવારની સેવાઓ માટે તાલીમ પામેલ સ્વયંસેવકોની યાદી બનાવવી.
૩				જન આરોગ્ય અને સ્વચ્છતાની બાબતો વિશે મીટીંગ કરવી તથા તેની વ્યક્તિગત અને સંસાધનોની જરૂરીયાતોનું અંદાજ પત્રક

				બનાવવું.
૪				કેમ્પ વ્યવસ્થા ટાસ્કફોર્સ સાથે જોડાણ કરી જરૂરી સ્વયંસેવકો, પ્રાથમિક સારવા કીટ અને અન્ય સ્વચ્છતા સેવાઓ પુરી પાડવી. પોલીસ અને સ્થાનિક આગેવાનો સાથે સંકલન માટે એક અધિકારીને નિયુક્ત કરવા. જે મૃતદેહોની યોગ્ય તપાસ અને નોંધણી બાદ નિકાલ કરાવે. તમામ પી.એમ. યુનિટ ખાતે વિદ્યુત જોડાણની વૈકલ્પિક વ્યવસ્થા કરવી.
૫	D+24 hours	કાર્ય વહેંચણી અને જરૂરીયાત ધરાવતા ક્લસ્ટરની ઓળખ	ટી.એચ.ઓ અને પી.એચ.સી સ્તરે	જિલ્લા મુખ્ય મથકે આરોગ્ય અને સ્વચ્છતા કમિટી બનાવવી.
૬				તમામ સ્થળોએ આરોગ્ય અને સ્વચ્છતાની પરિસ્થિતિ વિશે દેખરેખ કરી દૈનિક રીપોર્ટ બનાવવો. જિલ્લા મથક ખાતે દૈનિક મિટિંગ કરી પરિસ્થિતિ સમજવી અને રીસ્પોન્સ પ્લાન તૈયાર કરવો.
૭				પાણી સપ્લાય, સ્વચ્છતાને પ્રોત્સાહન,બાળ સંભાળ અને અન્ય જરૂરીયાતમંદ લોકોની જરૂરીયાત માટેનું અંદાજપત્રક સાથે રીપોર્ટ તૈયાર કરવો.
૮				જો તેઓને સહયોગની જરૂરીયાત હોય તો જિલ્લા ઓથોરીટીને સહયોગ માટે વિનંતી પત્ર લખવો.
૯				બચાવ દળ અને કેમ્પ સંચાલકો સાથે સંકલન કરવું કારણ કે જન આરોગ્ય સાથે જોડાયેલા પ્રશ્નો (જેવા કે સ્વચ્છ પાણી, સ્વચ્છતા, સેવાઓ, ધન કચરાનો યોગ્ય નિકાલ) અંગે કોઈ સમાધાન ન કરવું.
૧૦				રાહત કેમ્પ અને અન્ય વસાહતોમાં પ્રાથમિક જરૂરીયાતો(જેવી કે જન આરોગ્ય અને સ્વચ્છતા વગેરે)પુરી પાડવી.
૧૧	D+ Day 2	રીપોર્ટિંગ અને	સી.ડી.એચ.ઓ ,	આરોગ્યની સુવિધા આપતા ભૌતિક માળખાઓને

	and	ફાઈનલ	બી.એચ.ઓ	જો નુકસાન થયું હોય તો તેની ખાત્રી કરવી.
૧૨	ahead	દસ્તાવેજી કરણ	અને મેડીકલ ઓફિસર	સફાઈ ટુકડી બનાવીને સ્વચ્છતા અભિયાન ચલાવવું.
૧૩				કાર્યનું સતત રીવ્યું અને પુનઃઆંકલન કરતા રહેવું.
૧૪				જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન બને ત્યાં સુધી તમામ સેવાઓ અવિરત ચાલુ રાખવી. તમામ હિતધારકો સાથે મિટીંગ કરી જન આરોગ્ય સેવાઓ સમાપ્ત કરવી.
૧૫				ફાઈનલ રીપોર્ટ તૈયાર કરવો.

ટાસ્કફોર્સ – પશુ આરોગ્ય અને કલ્યાણ – આપત્તિગ્રસ્ત પ્રાણીઓના આરોગ્ય અને અન્ય સંભાળની જોગવાઈ કાર્યદળનું નેતૃત્વ લેનાર અધિકારી :- નાયબ નિયામક પશુ પાલન

ક્રમ	સમય પત્રક	ટાસ્ક	અમલ કરનાર વિભાગ	પ્રવૃત્તિ
૧	સામાન્ય સમય			પશુઓની યાદી અને તેમના સ્વાસ્થ્ય સંબંધીત વિગતો તૈયાર કરવી અને તકેદારીના પગલા લેવા.
૨				પશુ સ્વાસ્થ્ય કર્મીઓની સૂચી અને સંપર્ક યાદી તૈયાર કરવા.
૩				પશુઓ માટે પાંજરાપોળની યાદી તૈયાર કરવી.
૪				વીમા અંગે પ્રચાર પ્રસાર કરવો.
૫				નિઃસહાય સ્થળો ઓળખવા અને રીસ્પોન્સ માટે રણનીતિ તૈયાર કરવી.
૬	દરમ્યાન D O થી			અસરગ્રસ્ત પશુઓને ફેરવવા માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા.
૭	D+72 hours	જથ્થાની ચકાસણી	નાયબ નિયામકશ્રી, પશુ પાલન	પશુઓ અંગે રાહત, ઘાસચારો, પાણી અને દવાની વ્યવસ્થા અંગે
૮				પશુઓમાં મહામારી ન ફેલાય તે અંગે તકેદારી
૯				રીસપોન્સ કામગીરીની સમીક્ષા કરવી

૧૦				આપત્તિની પશુઓ અને સંબંધીત જીવનનિર્વાહ પર અસરનું દસ્તાવેજીકરણ અને કેસ સ્ટડી કરવું.
----	--	--	--	---

ટાસ્કફોર્સ – પાણી પુરવઠા વિભાગ – પાણીની જોગવાઈ કરવી.

કાર્યદળનું નેતૃત્વ લેનાર અધિકારી :- કાર્યપાલક ઈજનેર-પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ

ક્રમ	સમય પત્રક	ટાસ્ક	અમલ કરનાર વિભાગ	પ્રવૃત્તિ
૧	સામાન્ય સમય	પાણીના આવશ્યક જથ્થાની ચકાસણી	પાણી પુરવઠા વિભાગ	પાણી પ્રાપ્યતા, ક્ષમતા અને શુદ્ધતાનું સ્થાપન (કાર્યદળ)
૨				પાણી વિતરણ અને સંગ્રહ માટેના વૈકલ્પિક યોજના(કાર્યદળ)
૩				નવી અને વધારાની સાધનસામગ્રી સુનિશ્ચિત કરવી (કાર્યદળ)
૪				રસાયણો વાપરવા યોગ્ય પુરવઠા અને સાધનસામગ્રીનો વધારનો જથ્થો રાખવો.(કાર્યદળ)
૫				કર્મચારીઓની કમવાળી અને પાળી પધ્ધતિ
૬				પાણીના વપરાશ અંગે લોકજાગૃતિ કરવી.
૭				પાણીના પુરવઠાના સંરક્ષણ અંગે સરકારી અને ખાનગી ક્ષેત્રોને સુચના આપવી.(કાર્યદળ)
૮				કાર્ય વિશેષ દળના સભ્યોને સાબદા કરવા
૯				વધારાના સહાયક તંત્ર કર્મચારીગણ અને વાહનો ચકાસણી કરવી (સહાયક તંત્ર કાર્યદળ)
૧૦				વીજ પુરવઠાનું અને અન્ય કાર્યવિશેષદળ સાથે સંકલન
૧૧				પાણીના સ્ત્રોતની સ્થિતિ અને સંરક્ષણ(કાર્ય વિશેષ દળ)
૧૨				D+24 hours



૧૩		ધરાવતા ક્લસ્ટરની ઓળખ		પાણી પુરવઠાનું તંત્રની સ્થિતિ અને નુકસાનની આકારણી(કાર્યદળ)
૧૪				પાણી ટેન્કરો કામે લગાડવા(કાર્યદળ)
૧૫				પાણી પુરવઠા તંત્રનું સમારકામ/પુનઃસ્થાપન(યોજના આધારિત)
૧૬				પુરવઠા મથકો / વિતરણ સલામતીના વિતરણ
૧૭				પાણી વિતરણ વ્યવસ્થા કાર્યદળ ખાતરી કરવી.
૧૮				પાણીના વિતરણ અને સંગ્રહ અને પાણીના સલામત વપરાશની માહિતી પુરી પાડવાનું સંકલન.
૧૯	D + Day	રીપોર્ટીંગ અને ફાઈનલ દસ્તાવેજી કરણ	પાણી પુરવઠા અને ગ.વ્ય.બોર્ડ	કામચલાઉ પાણી પુરવઠા તંત્ર સ્થાપવું.
૨૦	2 and ahead			કાયમી પાણી પુરવઠા જથ્થા તરફ ધ્યાન આપવું.
૨૧				લાંબા ગાળાની પુનઃસ્થાપન યોજના અને જરૂરીયાતો પુર્ણ કરવી. (કાર્યદળ)
૨૨				રીપોર્ટીંગ અને દસ્તાવેજીકરણ શરૂ કરવું.(કાર્યદળ)
૨૩				બોધપાઠ બેઠક (કાર્યદળ અને અન્ય)
૨૪				આખરી અહેવાલ (કાર્યદળ)

ટાસ્કફોર્સ – વીજપુરવઠો – અસરગ્રસ્ત વિસ્તારમાં સામાન્ય વીજપુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે કાર્યદળનું નેતૃત્વ લેનાર અધિકારી : અધિક્ષક ઈજનેર એમ.જી.વી.સી.એલ ગુજરાત વિદ્યુત બોર્ડ.

ક્રમ	સમય પત્રક	ટાસ્ક	અમલ કરનાર વિભાગ	પ્રવૃત્તિ
૧	સામાન્ય સ્થિતિમાં		એમ.જી.વી.સી. એલ ગુજરાત વિદ્યુત બોર્ડ	વીજ પુરવઠા તંત્ર અને પ્રાપ્તિ સ્થાનોની વર્તમાન સ્થિતિની યાદી વિકસાવવી
૨				માહિક બેઠકો યોજવી
૩				સંપર્ક યાદી વિકસાવવી
૪				અનૌપચારીક જોખમો અને ખતરા આકારણી / મુલ્યાંકન હાથ ધરવું

૫				આપત્તિ આયોજન વિકસાવવું.
૬	D-24 hours	આવશ્યક જથ્થાની ચકાસણી	એમ.જી.વી.સી. એલ ગુજરાત વિદ્યુત બોર્ડ	પ્રમાણભુત સંચાલન કાર્યરીતી પ્રમાણે અસરોનું મુલ્યાંકન કરવું.
૭				પ્રતિભાવ પગલાને અગ્રતા આપવી
૮				વિજપુરવહો ખોરવાઈ નહી તેની તકેદારી રાખવા જરૂરી પગલા લેવાં.
૯				વધારાની સાધન સમગ્રી / સ્ત્રોત સાબદા કરવા
૧૦				અણધારી આકસ્મિકતા અંગે ખાતરી કરવી
૧૧	D+24 hours	કાર્ય વહેંચણી અને જરૂરયાત ધરાવતા ક્લસ્ટરની ઓળખ	એમ.જી.વી.સી. એલ ગુજરાત વિદ્યુત બોર્ડ	કામગીરી થયે માહિતી અને મુલ્યાંકનના આધારે યોજનામાં સુધારા કરવા.
૧૨				પગલાની / કાર્યવાહીની સ્થિતિની દેખરેખ
૧૩				માહિતીનો લોકોમા પ્રસાર કરવો.
૧૪				જરૂરીયાતો મુજબ સલામતી સુનિશ્ચિત કરવી.
૧૫				જરૂરીયાતો , આવશ્યકતાઓ અને પ્રાપ્તિસ્થાનો અંગે નિયંત્રણ કક્ષ અને ગ.વિ.બોર્ડના મુખ્ય મથક સાથે સતત સંપર્ક સ્થાપવો.
૧૬				પ્રયાસોમાં સુધારણ માટે ચકાસણી કરવી.
૧૭				મદ્યવર્તી સંકલન સંગીન બનાવવું.
૧૮				ભુમિકા ભજવનાર અન્ય પરીબળો સાથે નિયમિત સંકલન બેઠકો યોજવી.
૧૯				પ્રયાસોનું ઔપચારીક દસ્તાવેજીકરણ શરૂ કરવું.
૨૦				રાહત શિબીર / આશ્રય સ્થાનો પર વીજ પુરવહોની વૈકલ્પિક વ્યવસ્થા કરવી.
૨૧				સલામતી માટે આયોજનમાં ફેરફાર માટેની સમીક્ષા
૨૨				જરૂરી હોય તો વધારાની સલામતી સહિત સ્થિતિને સામાન્ય કરવા માટેની યોજના.

ટાસ્કફોર્સ :- જાહેરહેર બાંધકામ – સામાન્ય રીતે ચાલતા આંતર માળખાને પુનઃ સ્થાપીત કરવા માટે સ્થાનીક પ્રયાસોમાં સહાય કરવા માટે જરૂરી કર્મચારી ગણ અને સાધન સંપત્તિ પુરા પાડશે.

કાર્યદળનું નેતૃત્વ લેનાર અધિકારી કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન

ક્રમ	સમય પત્રક	ટાસ્ક	અમલ કરનાર વિભાગ	પ્રવૃત્તિ
૧	સામાન્ય સ્થિતિમા			કર્મચારીગણ, સાધનસામગ્રી અને આંતર માળખાની સુચી તૈયાર કરવી
૨				વાહનવ્યવહાર માટે વૈકલ્પિક રસ્તાઓ નક્કિ કરવા અને નકશાઓ રજુ કરવા.
૩				આંતર માળખાનું આપત્તિ પછી અગ્રતાના ધોરણે ઈન્સપેક્શન હાથ ધરવું.
૪				સાધનસંપત્તિ અને કર્મચારીગણના આયોજન અને નિભાવ
૫				સ્વચ્છતા અને આશ્રય માટેની અન્ય સવલતોની જોગવાઈ કરવી.
૬	D - 24 hours	આવશ્યક જથ્થાની ચકાસણી		કર્મચારી અને કાર્યદળોને સાબદા કરવા.
૭				નીયંત્રણ કક્ષ સ્થાપવો.
૮				જિલ્લા નિયંત્રણ કક્ષ સાથે સંપર્ક રાખવો.
૯	D + 24 hours	કાર્યવહેંચણી અને જરૂરીયાત ધરાવતા કલસ્ટરની ઓળખ		ટીમોને અગ્રતાના ધોરણે સાબદી રાખવી અને રવાના કરવી.
૧૦				નુકશાન આકારણી અને નિરીક્ષણ શરૂ કરવું.
૧૧				કામગીરી યોજના વિકસાવવી અને નિયંત્રણ કક્ષ સાથે સંપર્ક રાખવો.
૧૨				કર્મચારી ગણની કમવાળી પદ્ધતિ અને માનવ શક્તિ આયોજન શરૂ કરવું.
૧૩				નીયંત્રણ કક્ષ સ્થાપવો.
૧૪				રસ્તા, પ્રવેશ અને આંતરમાળખાને લગતી માહિતી પુરી પાડવી.
૧૫	D + Day 2 and ahead	રીપોર્ટીંગ અને દસ્તાવેજી કરણ	(આશ્રય વ્યવસ્થાપકો)	વિગતવાર મોંજણી હથ ધરવી.
૧૬				સાધનો અને અન્ય સાધન સંપત્તિની સુધારણા સમારકામ અને ફેરબદલી
૧૭				બોધપાઠ બેઠક
૧૮				ફાઈનલ રીપોર્ટ તૈયાર કરવો.

ટાસ્કફોર્સ - આશ્રય : આપત્તિગ્રસ્ત જન સમુદાયને કામચલાઉ આશ્રય આપવા માટે સાધનસામગ્રી અને પુરવઠો પૂરો પાડે છે.

કાર્યદળનું નેતૃત્વ લેનાર અધિકારી : જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી.

ક્રમ	સમય પત્રક	ટાસ્ક	અમલ કરનાર વિભાગ	પ્રવૃત્તિ
૧	સામાન્ય સ્થિતિમાં	કાર્યવહેંચણી અને જરૂરીયાત ધરાવતા ક્લસ્ટરની ઓળખ		આશ્રય સ્થાનનાં સંચાલન માટેની કાર્ય પધ્ધતિ વિકસાવવી.
૨				આશ્રય સ્થાનોના સ્થળ ,ક્ષમતા વગેરેની યાદી વિકસાવવી.
૩				અન્ય કાર્યદળના અધિકારીઓને આશ્રયસ્થાનો અંગે માહિતી પૂરી પાડવી.
૪				આશ્રય સ્થાનના સંચાલન માટેની કાર્યપધ્ધતિ વિકસાવવી.
૫	D - 24 hours			આશ્રય સ્થાનોના વ્યવસ્થાપકોને સાબદા કરવા(કાર્યદળ)
૬				સૂચના મુજબ આશ્રય સ્થાન શરૂ કરવા
૭				આશ્રય સ્થાન અને છાવણીઓ માટે વધારાના સ્ત્રોતને કામે લાગાવડા.
૮				આશ્રયસ્થાનોના સ્થાળ અને સ્થિતિ અંગે લોકોને વાકેફ કરવા.
૯				આશ્રય સ્થાન વ્યવસ્થાપકોને સાબદા કરવા.
૧૦				સૂચના મુજબ આશ્રય સ્થાન શરૂ કરવા.
૧૧	D + 24 hours	રીપોર્ટીંગ અને દસ્તાવેજી કરણ	(આશ્રય વ્યવસ્થાપકો)	આશ્રિતોને આશ્રય સ્થાનમાં દાખલ કરવાની કામગીરી શરૂ કરવી.
૧૨				આશ્રય સ્થાનના ઉપયોગની અગ્રતા માટેની યોજના કરવી.
૧૩				પાણી પુરવઠા, ખોરાક, આરોગ્યની સલામતી, માટે અન્ય કાર્યદળ સાથે સંકલન (કાર્યદળ)
૧૪				આશ્રિતોને સહાય અને મદદ પૂરી પાડવી.
૧૫				કામગીરી ચાલુ રાખવી (કાર્યદળ)

૧૬	D + Day 2 and ahead			આમ્રય સ્થાનોની સ્થિતિ અને લોકોની અવર-જવર પર દેખરેખ રાખવી (કાર્યદળ)
૧૭				વધારાની સાધન સામગ્રી કામે લગાડવી
૧૮				યોગ્ય જણાય તે મુજબ સાધનસામગ્રી તૈયાર કરવી.(કાર્યદળ)
૧૯				આમ્રય સ્થાનોની સ્થિતિમાં સુધારણા / સમારકામ શરૂ કરવું.(કાર્યદળ)
૨૦				બોધપાઠ
૨૧				આખરી અહેવાલ



# ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ગાંધીનગર.

જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર,

કલેક્ટર કચેરી, છોટાઉદેપુર.

ફોન નં-૦૨૬૬૯-૨૩૩૦૨૨, ૨૩૩૦૨૧, ૨૩૩૦૧૨

ફેક્સ-૦૨૬૬૯-૨૩૩૦૦૨